

Sumeet INDUSTRIES LIMITED

CIN: L45200GJ1988PLC011049

REGD.OFF.: 504, TRIVIDH CHAMBER, 5TH FLOOR, OPP. FIRE BRIGADE STATION, RING ROAD, SURAT-395002, INDIA
Phone (91-261) 2328902 · E-Mail: corporate@sumeetindustries.com · Visit us at: www.sumeetindustries.com

Date : 03/02/2024

To,
Department of Corporate Services
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, FORT,
Mumbai - 400 001

To,
National Stock Exchange of India Ltd
Exchange Plaza,
Bandra Kurla Complex,
Bandra (E),
Mumbai - 400 051

Symbol - SUMEETINDS

Scrip Code – 514211

Sub. : Copy of Newspaper Advertisement in respect of Result for the quarter and nine months ended on December 31, 2023 of M/s Sumeet Industries Limited (“Corporate Debtor” or “SIL”) which is currently undergoing Corporate Insolvency Resolution Process (“CIRP”)

Ref.: Compliance/Disclosure requirements pursuant to Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are submitting herewith a copy of newspapers cutting in respect of Un-audited financial result for the quarter and nine months ended on December 31, 2023, published on dated 03.02.2024 in the ‘Financial Express’ English edition, Ahmedabad and ‘Financial Express’ Gujarati edition (Regional Language), Ahmedabad.

This is for your information and record please.

Thanking you.

For Sumeet Industries Limited (under CIRP)

ANIL KUMAR
SUMERMAL
JAIN

Digitally signed by ANIL KUMAR
SUMERMAL JAIN
DN: c=IN, ou=Personal,
postalCode=395017, st=Gujarat,
serialNumber=EE48E838984883A
82482826468EE249AC9D55F836E
1D288ED80F2D4F35228E,
cn=ANIL KUMAR SUMERMAL JAIN
Date: 2024.02.03 12:41:42 +05'30'

Anil Kumar Jain
Company Secretary

Encl.: As above

Chartered Capital And Investment Limited... Regd. Office: 711, Main Road, Opp. US Hospital, Elidurga, Ahmedabad-380015...

NOTICE Pursuant to regulation 23 and regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of Board of Directors of the company will be held on Tuesday, February 13, 2024 at the registered office of the Company, inter-alia, to consider and approve Unaudited Financial Results of the company for the quarter/period ended December 31, 2023.

STARLINEPS ENTERPRISES LIMITED

CIN: L36910GJ2011PLC065141 Reg. Off. : Shop - F/1, 1st Floor, Athwa Ark Shopping Centre, Opp. Yatim Khana, Athwa Gate, Surat-395001, Gujarat. Tel.: 0261-2600343, Email: info@starlineps.com, Website: www.starlineps.com

Table with 5 columns: Sr. No., Particulars, Quarter ended 31/12/2023, Quarter ended 31/12/2022, Quarter ended 31/12/2022. Rows include Total Income from operations, Net Profit, and Earnings Per Share.

Notes: 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and Nine Months ended on 31.12.2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

FOR STARLINEPS ENTERPRISES LIMITED Sd/- SHWETKUMAR KORADIYA Chairman & Managing Director DIN: 03489858

THE SANDESH LIMITED

CIN: L2212GJ1943PLC00183 Registered Office: "Sandesh Bhavan", Lad Society Road, B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad-380054

NOTICE

(For the attention of Equity Shareholders of the Company) Sub: Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority This Notice is published pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 ("Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended ("Rules").

The Act and Rules, amongst other matters, contain provisions for the transfer of unpaid and unclaimed dividends to Investor Education and Protection Fund established by the Central Government.

Place : Ahmedabad Date : February 02, 2024

Branch Office : Office No. 501 to 504, 5th Floor, Ornate One, Silver Stone Main Road, 150ft Ring Road, Rajkot, Gujarat - 360005 Registered & Corporate Office : Yes Bank Limited, Yes Bank House, Off Western Express Highway, Santacruz East, Mumbai - 400055. POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY

Regional Office, Ahmedabad : The South Indian Bank Ltd., Regional Office, Ahmedabad : 4th Floor, Sakar VII, Nehru Bridge Jn. Ashram Rd. Navrangpura, Ahmedabad, Gujarat-380009

Ref: RO-AHMD/IBC/E-auction/05 E-AUCTION SALE NOTICE Date: 01-02-2024 E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) and 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Table with columns: Name of Property Owner, Description of property, Reserve Price, Earnest Money Deposit (EMD), Bid Increment amount, Date and time of E-auction, Encumbrances known to the Bank.

Sumeet INDUSTRIES LIMITED

EXTRACT OF CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON 31/12/2023 (₹ in Lakh)

Table with 5 columns: Sr. No., Particulars, Quarter ended 31/12/2023, Quarter ended 31/12/2022, Quarter ended 31/12/2022, Year ended 31/03/2023. Rows include Total Income from operations, Net Profit, and Earnings Per Share.

NOTE :- 1. The above is an extract of the detailed format of Un-Audited Financial Results for the quarter and nine months ended 31.12.2023, filed with the Stock Exchange(s) under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

PLACE : Surat DATE : 01/02/2024 CIN No. L45200GJ1988PLC011049 Regd. Office : 504, Trivich Chambers, Opp. Fire Station, Ring Road, Surat - 395 002, India.

DEBTS RECOVERY TRIBUNAL-II Ministry of Finance, Department of Financial Service, Government of India

FORM NO.22 (Earlier 62) [Regulation 36 & 37 of DRT Regulations, 2015] [See Rule 52 (1)(2) of the Second Schedule to the Income-Tax Act, 1961] READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993

E-AUCTION/SALE NOTICE

RP/RC No. 40/2020 Certificate Holder Bank :- State Bank of India V/s Certificate Debtors :- M/s. Vrunda Developers & Anr To, C.D.No. 1: M/s. Vrunda Developers, (A Proprietorship firm)

Table with 4 columns: Lot No., Description of the Property, Reserve Price (Rounded off), EMD 10% or (Rounded off). Row 1: Plot No. A/4, Panchratna Housing Society, situated at land bearing Revenue Survey No. 505-515-517-570/1-572/2 Final Plot No.: 823, 830, 846, 835, of T.P.S. No.3, mouje Village Bapod, Registration District : Vadodara and Sub District : Danteshwar.

Note* In respect of any claims to be received, if any, priority of payment will be decided in terms of Section 31-B of the RDB Act, 1993(as amended in the year 2016).

Table with 2 columns: Beneficiary Bank Name, Beneficiary Bank Address, Beneficiary Account No., IFSC Code. Row 1: State Bank of India, SARB Vadodara, 40253211845, SBIN0001141

- (1) The bid increase amount will be Rs. 10,000/- for Single lot. (2) Prospective bidders may avail online training from service provider M/s E-Procurement Technologies Ltd. (Tel Helpline No. 9265562821 - 079 61200594/ 598/ 587/538 and Ram Sharma (Mobile No. 9978591888), Helpline E-mail ID : support@auctiontigger.net

SCHEDULE OF AUCTION Table with 3 columns: Description, Date, Time. Row 1: Inspection of property, 12.02.2024 Between 11.00am to 2.00 pm.

Sd/- Recovery Officer-II, Debts Recovery Tribunal-II, Ahmedabad

KVB Karur Vysya Bank Plot No. 9, Ground Floor, Nr SBI Main Branch, Banking Circle, Sector No. 9, Gandhidham-370201 Email id: gandhidham@kvbmail.com Ph No: 02836-235029/28

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor (s) that the below described immovable properties mortgaged/ charged to the Secured Creditor, The Karur Vysya Bank Ltd, the physical possession of which has been taken by the Authorised Officer of The Karur Vysya Bank Ltd, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 28th February 2024 for recovery of Rs. 82,47,25,224.89 (Rs. Eighty Two Crores Fourteen Lakhs Twenty Five Thousand Two Hundred Twenty Four and Paise Eighty Nine Only) as on 31.01.2024 due to the Karur Vysya Bank Ltd, Secured Creditor from

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Details as per Mortgage Document: Property comprising of following three contiguous immovable properties (factory land and building) comprised in revenue survey No. 347 Paik, a. Land admeasuring acre 2.16 guntha (9712.80 sqmtrs) (being the remaining portion of survey No. 347 ie. Other than plot no 1 and 2), b. Plot No.1 admeasuring 19680 sqmtrs c. Plot No.2 admeasuring 15606.50 sqmtrs. Situated at village Nani Chirai, Taluka Bhachau, Distt. Kutch, Gujarat, Standing in the name of Mr. Anil Kumar Goyal S/o Mr. Prem Sagar Goyal

East: Government waste land and service road, West: Murrum Road approaching next entry of property, North: Oswal Extrusion Limited in Village Varsana Seem, South: RS-No.348/1 & 2 and then service road to Gandhidham Ahemdabad Highway.

For detailed terms and conditions of the sale, please refer to the link provided in Our Bank's / Secured Creditor's website i.e www.kvb.co.in/Property Under Auction also at the web portal https://sarfaesi.auctiontigger.net/ of the service provider M/s E-Procurement Technologies Limited, B-704, Wall Street - II, Opp. Orient Club, Nr. Gujarat College, Ellis Bridge, Ahmedabad - 380006 Gujarat (India), Contact Person: Ram Sharma - 9978591888, Helpline No. 9265562821 / 18 - 079 6813 6842/ 837, Helpline E mail ID: Support@auctiontigger.net, rampurasd@auctiontigger.net.

Statutory 15 days' Notice under Rule 9(1) of the SARFAESI Act, 2002 The Borrower and guarantor/s are hereby notified to pay the dues as mentioned above along with up to date interest and ancillary expenses within 15 days of receipt of this notice, failing which the Schedule property will be auctioned/sold and balance dues, if any, will be recovered with interest and cost.

Authorized Officer, The Karur Vysya Bank Ltd.

Indian Bank ZONAL OFFICE SURAT : 101-102, 3rd FLOOR, WEST FIELD SQUARE, SURAT-395007 E-AUCTION NOTICE- FOR SALE OF IMMOVABLE PROPERTIES [See Proviso Rule 8(6)] ANNEXURE-II E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002

રાશી પેરિફેરલ્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. ૨૮૫-૩૧૧ નક્કી કરી

પીટીઆઈ નવી દિલ્હી, તા. ૨ ફેબ્રુઆરી - ઈન્વેસ્ટમેન્ટ્સ મ્યુનિફિશનલ્સ ડેવલપમેન્ટ પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા રાશી પેરિફેરલ્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. ૨૮૫-૩૧૧ નક્કી કરી છે. આઈપીઓ ૭ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી ચાલેલ ભરણાં માટે ખુલ્લો રહેશે અને એન્ડર સ્ક્રીપ્શન માટે બિડિંગ ૯ ફેબ્રુઆરીએ એક દિવસ માટે ખુલશે.

શ્રી ગણેશ રેમેડીઝ લીમિટેડ
CIN No.: L24230GJ1995PLC025661
રજિસ્ટર્ડ ઓફિસ : પ્લોટ નં. ૧૦૧૧, G.I.D.C., અંકલેશ્વર - ૩૮૩૦૦૨, ગુજરાત, ભારત.
ફોન : ૭૫૭૪૨૯૬૦૬૭ • Web: www.ganeshremedies.com
Email : investors@ganeshremedies.com

પાર્ટની પેઇડ-અપ ઇક્વિટી શેરહોલ્ડર સંબંધિત અધિકારો

યુકવણીની અવધિમાં ફેરફાર માટે સુચના
આ કોર્પોરેટ "શુદ્ધિપત્ર" શ્રી ગણેશ રેમેડીઝ લીમિટેડની અંતિમ કોલ નોટિસના સંબંધમાં પ્રકાશિત તારિક્કાના જાહેરાત, ૨૦૨૩ના રોજના જાહેરાત સાથે વાંચવા માટે.

શેરહોલ્ડરનો આ રજીસ્ટર્ડ ઓફિસ, ૨૦૨૩ના રોજ પ્રકાશિત થયેલ જાહેરાતમાં કોલ મની યુકવણી સમયગાળામાં નીચેના ફેરફારોની નોંધ લઇ શકે છે.

કંપનીના ઓફિસ ડિરેક્ટરોનું નામ ડૉ. રમણચંદ્ર ઠાકર ના નામને અપાડવામાં આવ્યું છે. આ ફેરફારનો અર્થ એ છે કે તેઓ તેની ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ યોજાયેલી મીટિંગમાં રાજીનામું આપવાનો અર્થ આજીવન સુધી વાળે છે. તે સિવાય, ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૨૪ થી સોમવાર, ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી, અન્ને દિવસો સહિત, યુકવણી પાત્ર છે.

રજીસ્ટર્ડ ઓફિસ, ૨૦૨૩ના રોજ પ્રકાશિત થયેલ જાહેરાત, આ શુદ્ધિપત્ર સાથે મળીને વાંચવો અને ઉપર દર્શાવેલ માહિતીની મર્યાદામાં યોગ્ય રીતે સંશોધિત કરવી. શ્રી ગણેશ રેમેડીઝ લીમિટેડ વતી રાજી/ સહી/ તારીખ : ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ કંપની સેક્રેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસર

સ્થળ : અંકલેશ્વર સતી નરવાણી તારીખ : ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ કંપની સેક્રેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસર

કરોડના ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા રાશી પેરિફેરલ્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. ૨૮૫-૩૧૧ નક્કી કરી છે. આઈપીઓ ૭ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી ચાલેલ ભરણાં માટે ખુલ્લો રહેશે અને એન્ડર સ્ક્રીપ્શન માટે બિડિંગ ૯ ફેબ્રુઆરીએ એક દિવસ માટે ખુલશે.

આ આઈપીઓ સંપૂર્ણપણે ઇક્વિટી શેરનો રૂપિયા ૬૦૦ કરોડનો નવો આઈપીઓ છે, જેમાં કોઈ એન્ડર-સ્ક્રીપ્શન કમ્પોનેન્ટ નથી.

Chartered Capital And Investment Limited
Regd Office: T.1, Mainat, Opp. V.S. Hospital, Alipada, Ahmedabad-380005.
Ph: 079-2657 5337 Fax: 079-2657 5731. CIN: L42101GJ1988PLC008577
Email: info@chartercapital.in Website: www.charteredcapital.net

For, Chartered Capital And Investment Limited
Place: Ahmedabad Mohib N Khericha
Date: February 2, 2024 Managing Director

DALMIA BHARAT SUGAR AND INDUSTRIES LIMITED

Regd. Office : Dalmiapuram - 621 651, Distt. Tiruchirapalli (Tamil Nadu)
Phone : 011 23465100, Fax (011) 23313303
Email : sec.corp@dalmiasugar.com . Website : www.dalmiasugar.com . CIN : L15100TN1951PLC000640
Extract of Unaudited Consolidated Financial Results for the quarter and nine months ended 31-12-2023
(₹ in Crore except earning per share data)

S.No.	Particulars	For the quarter ended			For the nine months ended		For the year ended
		31-12-2023	30-09-2023	31-12-2022	31-12-2023	31-12-2022	31-03-2023
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	610.12	787.50	622.76	2240.74	2166.01	3327.66
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items.)	95.65	74.02	93.40	256.88	179.88	355.57
3	Net Profit/(Loss) for the period before Tax (After Exceptional and/or Extraordinary items.)	95.65	74.02	93.40	256.88	179.88	355.57
4	Net Profit/(Loss) for the period after Tax (After Exceptional and/or Extraordinary items.)	64.92	54.90	64.91	181.16	125.89	250.07
5	Total Comprehensive Income for the period [comprising profit/(Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	27.34	121.61	138.20	267.14	221.20	378.63
6	Equity Share Capital	16.19	16.19	16.19	16.19	16.19	16.19
7	Earning per Share (face value of ₹ 2 each)						
a)	Basic	8.02	6.78	8.02	22.38	15.55	30.90
b)	Diluted	8.02	6.78	8.02	22.38	15.55	30.90

Standalone Financial Results							
1	Total Income from Operations	607.28	787.50	622.76	2237.90	2166.01	3327.66
2	Net Profit (Loss) for the period before Tax	92.84	74.02	93.40	254.06	179.88	355.57
3	Net Profit (Loss) for the period after Tax	62.11	54.90	64.91	178.34	125.89	250.07

Notes :-
1. The above financial results are approved by the Board of Directors at their meeting held on Feb 02, 2024 after being reviewed and recommended by the audit committee. The statutory auditors have carried out the limited review of these financial results and have given an unmodified opinion.

2. The above is the extract of the detailed format of quarterly/nine months financial results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results is available on the Stock Exchange websites, www.nseindia.com, www.bseindia.com and on the Company website www.dalmiasugar.com.

3. The Board has approved an interim dividend @ ₹ 3.75/- per share (face ₹ 2/- per share) for the financial year 2023-24.

4. The Board has approved a scheme of demerger of its non-core businesses (refractory and travel agency businesses) into Dalmia Bharat Refractories Limited (DBRL) with appointed date of 1st July 2023 at a share swap ratio of 1 equity share of DBRL for 48.18 shares of Dalmia Bharat Sugar and Industries Limited.

For Dalmia Bharat Sugar and Industries Limited
B B Mehta
Whole Time Director

Place: New Delhi
Date: Feb 02, 2024

SUMMET INDUSTRIES LIMITED

EXTRACT OF CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON 31/12/2023

(₹ in Lakh)

Sr. No	Particulars	QUARTER ENDED		Nine Month ENDED		Year ENDED
		31/12/2023	31/12/2022	31/12/2023	31/12/2022	31/03/2023
		Un-Audited	Un-Audited	Un-Audited	Un-Audited	Audited
1	Total Income from operations (net)	22713.10	26490.05	71417.95	79627.86	104334.65
2	Net Profit / (Loss) for the period before Tax and Exceptional items	-1653.84	-2894.43	-5126.14	-6761.96	-6375.17
3	Net Profit / (Loss) for the period before tax after Exceptional items	-1653.84	-2894.43	-5126.14	-6761.96	-6376.97
4	Net Profit / (Loss) for the period after tax and Exceptional items	-1653.84	-2513.21	-5126.14	-6380.74	-5872.16
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	91.43	107.59	-16.84	-153.28	-479.29
6	Paid up Equity Share Capital	10364.24	10364.24	10364.24	10364.24	10364.24
7	Other Equity excluding Revaluation Reserves	-	-	-	-	-21997.89
8	Earnings Per Share (of Rs. 10/- each not annualised) (for continuing and discontinued operations)					
	1. Basic	-1.51	-2.32	-4.96	-6.30	-6.13
	2. Diluted	-	-	-	-	-

NOTE :-
1. The above is an extract of the detailed format of Un-Audited Financial Results for the quarter and nine months ended 31.12.2023, filed with the Stock Exchange(s) under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the website of the Stock Exchange(s) BSE: www.bseindia.com and NSE: www.nseindia.com and website of the Company: www.sumeetindustries.com.

2. The above Un-Audited Financial Results for the quarter and nine months ended on 31st December 2023, were reviewed and approved by the Board of Directors (Suspended) and taken on records by Resolution Professional (RP) on February 01, 2024.

3. The Corporate Insolvency Resolution Process of Summeet Industries Limited has been initiated vide the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench order dated 20.12.2022, under Section 7 of the Insolvency and Bankruptcy Code, 2016 ("IBC"/ "Code"), filed by IDBI Bank Limited. Mr. Satyendra P. Khoriania (Reg. No. IBBI/IPA-002/IP-N00002/2016-17/10002) has been appointed as Resolution Professional ("RP") of the company.

For and on behalf of the Board
SUMMEET INDUSTRIES LIMITED
Shankarlal Somani (Director)

PLACE : Surat
DATE : 01/02/2024

CIN No. L45200GJ1988PLC011049
Regd. Office : 504, Trivith Chambers, Opp. Fire Station, Ring Road, Surat - 395 002. India.
E-mail : corporate@sumeetindustries.com, Visit us at : www.sumeetindustries.com

કરુર વેશ્ય બેંક લીમિટેડ

KVB Karur Vysya Bank
Smart way to bank

ધો. ૨ નં. ૬, ગ્રાહિત્ કલોર, એસ.બી.આઈ. મેડન શામા ની પાસે, બેંકિંગ સર્કલ, સેક્ટર નં. ૬ ગાંધીધામ, -૩૯૦૨૦૧ મોબાઇલ : id.gandhidham@kvbmail.com ફોન નં. : ૦૨૮૩૨-૨૩૦૨૨/૨૬,

સ્થાયર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટિસ

સિક્યુરીટીઝીયન એન્ડ રીફાઇન્સમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક્વિટી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ પ્રોડક્ટ્સ લિમિટેડ, ૨૦૨૨ ના રૂ. ૬૯ (₹) સિક્યુરીટી ઇન્વેસ્ટમેન્ટ (એક્વિટી) નિયમો ૨૦૦૨ સાથે વંચાણે લેવા સ્થાયર મિલકતો માટે ઇ-દારાણી થી વેચાણની નોટિસ.

આથી ખાસ કરીને ઇન્દોર(ઓ) જામીનદાર(ઓ) અને સામાન્ય રીતે જાહેર વતનાનો નોટિસ આપી જવાવાળાને કે નીચે જણાવેલ સ્થાયર મિલકત જે મુકરર લેહાદારને ગિરવે મુકવા/તારણમાં મુકેલ છે જેનો પ્રકાશ કરવામાં મુકેલ છે. જેમાં નીચેના "જ્યાં" નાં છે તેવાં છે, જેની છે તેવી છે. અને જે છે તે તેમાં "ના" ધોરણે તારીખ તા. ૨૮.૦૨.૨૦૨૪ ના રોજ રૂ. ૮૨,૪૭,૨૫,૨૨૪.૮૬ (રૂ. ઠાંસો કરોડ સુડતાળીસ લાખ પચ્ચીસ હજાર અસો ચોવીસ અને પૈસા નેવ્યાસી ફક્ત) ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ (૧) મે.આગાદ ઈમેલ પ્રાઈવેટ લીમિટેડ, રજી. ઓફિસ : ખરાત નં. ૭૩/૧૬/૨ અને ૨૨/૧, સોલ રોડ, ગામ મુંદકા, ન્યુ દિલ્હી-૧૧૦૦૨૧, (૨) શ્રી અનિલકુમાર ગોયલ S/O-શ્રી પ્રેમસાગર ગોયલ રહેવાસી : ૪૫૦, પહેલો માળ, દીપાલી, પીતમપુરા, દીલ્હી-૧૧૦૦૩૩, (૩) શ્રી આકાશ ગોયલ S/O- શ્રી અનિલકુમાર ગોયલ રહેવાસી : ૪૫૦, પહેલો માળ, દીપાલી, પીતમપુરા, દીલ્હી-૧૧૦૦૩૩, (૪) શ્રીમતી રેણુ અગરવાલ W/O સુમિત ગોયલ, રહેવાસી : ૪૫૦, પહેલો માળ, દીપાલી, પીતમપુરા, દીલ્હી-૧૧૦૦૩૩, (૫) શ્રીમતી સુમત રાણી W/O શ્રી અનિલકુમાર ગોયલ રહેવાસી : ૪૫૦, પહેલો માળ, દીપાલી, પીતમપુરા, દીલ્હી-૧૧૦૦૩૩, (૬) શ્રી સુમિત ગોયલ S/O-શ્રી ચંદ ગોયલ, ૪૫૦, પહેલો માળ, દીપાલી, પીતમપુરા, દીલ્હી-૧૧૦૦૩૩, ની પાસેથી ડી કરૂર વેશ્ય બેંક લી., મુકરર લેહાદારના બાકી નીકળતા લેણાની વસુલાત માટે કરવામાં આવશે. અનામત કિંમત આઈટમ નં. ૧ની : રૂ. ૧૨,૬૩,૦૦,૦૦૦/- (રૂ. બાર કરોડ બેસાઠ લાખ ફક્ત) અને અર્નર્સ્ટ એન્ડ યંગની સીપીઆઈટી : રૂ. ૧,૨૬,૩૦,૦૦૦/-.

સ્થાયર મિલકતોનું વર્ણન

ગિરવે દસ્તાવેજ પ્રમાણેની વિગત : મહેસુલ સર્વે નં. ૩૪૭ પેકીમાં સમાવિષ્ટ નીચેની ગ્રાહ સલગન સ્થાયર મિલકતો (ફેક્ટરીની જમીન અને મકાન) નો સમાવેશ થાય છે.

ઓ. જમીન નું ક્ષેત્રફળ એકર ૨.૧૬ ગુંડા (૯૭૧૨.૮૦ સ્કે.મીટર) (સર્વે નં. ૩૪૭નો બાકીનો હિસ્સો એટલે કે તેના વિચાય પ્લોટ નં. ૧ અને ૨),

બી. પ્લોટ નં. ૧ ક્ષેત્રફળ ૧૬૬૮૦ સ્કે.મીટર સી. પ્લોટ નં. ૨ ક્ષેત્રફળ ૧૬૬૮૦ સ્કે.મીટર

શ્રી અનિલકુમાર ગોયલ S/O શ્રી પ્રેમસાગર ગોયલ ના નામે ગામ નાની ચિરાઈ ખાતે સ્થિત તાલુકો ભયાઈ, સુલ્લો કચ્છ, ગુજરાત,

તારીખ મુજબ સાર્થ મુજબ વિગત : મહેસુલ સર્વે નં. ૩૪૭ પેકીમાં સમાવિષ્ટ નીચેની ગ્રાહ સલગન સ્થાયર ઓદ્યોગિક શ્રી હેલ્થ મિકલ્નો (ફેક્ટરીની જમીન અને મકાન) નો સમાવેશ થાય છે.

ઓ. જમીન નું ક્ષેત્રફળ એકર ૨.૧૬ ગુંડા (૯૭૧૨.૮૦ સ્કે.મીટર) (સર્વે નં. ૩૪૭નો બાકીનો હિસ્સો એટલે કે તેના વિચાય પ્લોટ નં. ૧ અનુ ૨),

બી. પ્લોટ નં. ૧ ક્ષેત્રફળ ૧૬૬૮૦ સ્કે.મીટર સી. પ્લોટ નં. ૨ ક્ષેત્રફળ ૧૬૬૮૦ સ્કે.મીટર

કુલ ક્ષેત્રફળ ૪૪૯૯૦.૩૦ સ્કે.મીટર સાથે : (૧) મકાન (ઓ) ઓફિસ બ્લોક ૧૩૨ સ્કે.મીટર ની (બી) સ્ટાફ ક્વાર્ટર્સ ૨૩૦ સ્કે.મીટર સી) સ્ટાફ ક્વાર્ટર્સ અને ગેરરૂમ ૩૨૨ સ્કે.મીટર (ડી) ઇલેક્ટ્રીકલ અને સ્ટોર ૩૨૪ સ્કે.મીટર (ઈ) લેબર ક્વાર્ટર્સ ૩૨૨ સ્કે.મીટર અને (૨) ઓદ્યોગિક શેડ (૨) સો મિલ નો શેડ નં. ૧, ૨૬૯૦ સ્કે.મીટર (૨) સો મિલ નો શેડ નં. ૨, ૨૦૨૫ સ્કે.મીટર અને પુલ્કો ડી.બી. રૂમ ૩૩ સ્કે.મીટરનો અને અનર્સ્ટ ગ્રાહિત્ આર.સી.સી. પાણીની ટાંકી ૮૦,૦૦૦ લીટરની, સોલર હોટ વોટર ૧૮ સ્કે.મીટર શ્રી અનિલકુમાર ગોયલ S/O શ્રી પ્રેમસાગર ગોયલ ના નામે ગામ નાની ચીરાઈ, તાલુકો ભયાઈ, સુલ્લો કચ્છ, ગુજરાત

ચતુ: સીમા નીચે મુજબ : પૂર્વ : સરકારી ખરાતના જમીન અને સર્વિસ રોડ પશ્ચિમે : પછીની મિલકતની પ્રવેશદ્વાર ને ખેડેટી મુકમ રોડ, ઉત્તરે : ઓસ્વાલ એકસ્ટ્રુક્શન લીમિટેડ ગામ વરસાવા સીમમાં, દક્ષિણે : આરએસ. નં. ૩૪૮/૧ અને ૨ અને તે પછી ગાંધીધામથી અમદાવાદ (દાહલે સર્વિસ રોડ

વેચાણની શરતો અને નિયમો માટે કૃપા કરી અમારી બેંક / મુકરર લેહાદારની વેબસાઈટ : એટલે કે www.kvb.co.in / પ્રોપર્ટી ઍન્ડ આકાશન અને વેબ પોર્ટલ <https://sarfaesi.auctiontiger.net>, સર્વિસ પ્રોવાઈડર મેસર્સ ઈ-પ્રોક્વોસ્ટમેન્ટ ટેકનોલોજી લિમિટેડ, બી-૭૦૪૨, વોલ રજીટ - ૨, ઓરિએન્ટ ક્લબ સામે, ગુજરાત કોલેજ પાસે, એસિસ ટ્રિપ્લ, અમદાવાદ - ૩૮૦૦૦૬ ગુજરાત (ભારત), સંપર્ક વ્યક્તિ - રામ શર્મા - ૯૯૦૮૫૫૮૮૮, હેલ્પલાઈન નં. ૯૨૬૫૬૨૨૨૧ / ૧૮ - ૭૭૬ ૬૮૧૩ ૬૮૪૨ / ૮૩૭, હેલ્પલાઈન ઈ-મેલ આઈડી: Support@auctiontiger.net, ramprasad@auctiontiger.net નો સંપર્ક કરી શકાય છે.

સરફેસી એક્ટ ૨૦૦૨ ના નિયમ ૬(૧) હેઠળ ૧૫ દિવસની કાચદાકીની નોટિસ

દેવાદાર/ખામીનદારને આ નોટિસ મારફતે ઇવોલ્ટ જણાવેલ બાકી લેણાની રકમ તથા રકમ વ્યાજ અને આનુસંગિક ખર્ચોનો સાથે જાહેર ઈ-દારાણી તારીખ ૧૫ દિવસ પહેલાં ચુકવવા જણાવવામાં આવે છે. જે તેમ કરવામાં નિષ્ફળ જાય તો સ્થાયર મિલકતોની જાહેર દારાણી/વેચાણ કરી અને બાકી રહેતી રકમ વ્યાજ અને ખર્ચોનો સાથે વસુલાત કરવા કાનૂની રાહે પગલાં લેવામાં આવશે.

જો કોઈ બંધો હોય તો : બેંકને ગુજરાતના રાજ્ય કર વિભાગ તરફથી કરની બાકી રકમ અંગે નોટિસ મળે છે. સહી/ તારીખ : ૦૩.૦૨.૨૦૨૪, સ્થળ : ગાંધીધામ અધિકૃત અધિકારી, ડી કરૂર વેશ્ય બેંક લિમિટેડ

INTERGLOBE AVIATION LIMITED

CIN: L62100DL2004PLC129768
Registered Office: Upper Ground Floor, Thapar House, Gate No. 2, Western Wing, 124 Janpath, New Delhi - 110001, India
Tel: +91 96500 98905; Fax: +91 11 4351 3200
E-mail: investors@goindigo.in; Website: www.goindigo.in

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2023

(Rupees in millions, except for share data and if otherwise stated)

S.No.	Particulars	Consolidated		
		Three months period ended 31 December 2023	Nine months period ended 31 December 2023	Three months period ended 31 December 2022
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Revenue from operations	194,521.48	510,790.75	149,329.70
2	Net Profit / (Loss) for the period (before Tax and / or Exceptional items)	29,985.11	62,783.43	14,233.10
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	29,985.11	62,783.43	14,233.10
4	Net Profit / (Loss) for the period after tax	29,981.20	62,776.50	14,226.04
5	Total Comprehensive Income / (Loss) for the period	29,863.00	62,633.64	14,199.60
6	Equity share capital (face value of Rs. 10 each, fully paid)	3,859.45	3,859.45	3,854.75
7	Earnings Per Share (of Rs. 10 each)			
	1. Basic (Rs.):	77.69	162.75	36.91
	2. Diluted (Rs.):	77.58	162.54	36.86

EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2023

(Rupees in millions, except for share data and if otherwise stated)

S.No.	Particulars	Standalone		
		Three months period ended 31 December 2023	Nine months period ended 31 December 2023	Three months period ended 31 December 2022
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Revenue from operations	194,521.48	510,790.75	149,329.70
2	Net Profit / (Loss) for the period (before Tax and / or Exceptional items)	29,984.94	62,736.00	14,181.72
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	29,984.94	62,736.00	14,181.72
4	Net Profit / (Loss) for the period after tax	29,984.94	62,736.00	14,181.72
5	Total Comprehensive Income / (Loss) for the period	29,868.43	62,563.32	14,160.97

Notes:
1. The above is an extract of the detailed format of unaudited consolidated financial results and unaudited standalone financial results for the quarter and nine months ended 31 December 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the "SEBI LODR Regulations"). The full format of the unaudited consolidated financial results and unaudited standalone financial results for the quarter and nine months 31 December 2023 is available on the website of the Company www.goindigo.in and also at the website of the stock exchanges www.nseindia.com and www.bseindia.com. The results have been subjected to a limited review by the Statutory Auditors of the Company and its subsidiary (namely 'Agile Airport Services Private Limited') [the Company and its subsidiary together referred to as 'the Group'] pursuant to Regulation 33 of the SEBI LODR Regulations, who have issued an unmodified conclusion on the same.

2. The above results were reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on 2 February 2024.

3. Earnings per share is not annualized for the quarter ended 31 December 2023 and 31 December 2022 and nine months period ended 31 December 2023.

For and on behalf of the Board of Directors of InterGlobe Aviation Limited

Sd/-
Rahul Mehta
Managing Director

Place : Gurugram
Date : 2 February 2024